

Disclaimer

"This is an automated (system-generated) translation provided for convenience. If there is any ambiguity or inconsistency between this translation and the English version of the document, the English version will prevail to the extent permitted by applicable law. If you need any clarification, please call our toll-free number [1800 572 3013] and we will assist you."

અસ્વીકરણ

"આ એક સ્વયંચાલિત (સિસ્ટમ-જનરેટેડ) અનુવાદ છે જે સુવિધા માટે આપવામાં આવ્યો છે. જો આ અનુવાદ અને દસ્તાવેજના અંગ્રેજી સંસ્કરણ વચ્ચે કોઈ અસપષ્ટતા અથવા અસંગતતા હશે, તો લાગુ કાયદા દ્વારા માન્ય હદ સુધી અંગ્રેજી સંસ્કરણ માન્ય રહેશે. જો તમને કોઈ સ્પષ્ટતાની જરૂર હોય, તો કૃપા કરીને અમારા ટોલ-ફ્રી નંબર [1800 572 3013] પર કોલ કરો અને અમે તમને મદદ કરીશું."

આ દસ્તાવેજ તમારી પોલિસી વિશે ફક્ત મુખ્ય માહિતી પ્રદાન કરે છે. વિગતવાર નિયમો અને શરતો માટે કૃપા કરીને પોલિસી દસ્તાવેજનો સંદર્ભ લો.

ડા નં.	શીર્ષક	વર્ણન	નીતિ વિભાગ નંબર
		(કૃપા કરીને આગામી કોલમમાં લાગુ પોલિસી ક્લોઝ નંબરનો સંદર્ભ લો)	
1.	વીમા ઉત્પાદનનું નામ	ક્ષેમ પ્રકૃતિ	આઈ
2.	IRDAI દ્વારા ફાળવેલ અનન્ય ઓળખ નંબર		
3.	વીમા ઉત્પાદનનું માળખું/પ્રકાર	વળતર: પાકના સમયગાળાને અનુરૂપ પાકના મૂલ્ય પર સેટેલાઈટ છબી / એપ્લિકેશન દ્વારા મેળવેલા ચિત્રો દ્વારા નુકસાનની ટકાવારી લાગુ કર્યા પછી વળતરની રકમ પ્રાપ્ત થશે.	આઈમો
4.	વીમા રકમ	વીમા સમયગાળા દરમિયાન કોઈપણ એક દાવા માટે અથવા બધા દાવાઓ માટે અમે જે મહત્તમ રકમ ચૂકવીશું તે પોલિસી શેડ્યૂલમાં દર્શાવેલ છે. પશુ હુમલાના કવરેજ માટે, ચુકવણી કુલ વીમા રકમના 25% સુધી મર્યાદિત છે અને તે એકંદર પોલિસી વીમા રકમમાં શામેલ છે.	II
5.	વીમાકૃત રુચિઓ / કવરેજ માટેના વિભાગો	આ ઉત્પાદન માલિક ખેડૂતો / ભાડૂઆત ખેડૂતોને વીમા કવચ આપે છે, જેઓ મહત્તમ 180 દિવસની અવધિ સાથે મોસમી પાકની ખેતી કરે છે.	

6.	પોલિસી કવરેજ (પોલિસી શું કવર કરે છે?)	નીચેના જોખમો થવા પર, જેના પરિણામે પાકને નુકસાન થાય છે, તમે આ નીતિ હેઠળ દાવા માટે હકદાર હશો; નામિત ચક્રવાત સુનામી સહિત ભૂકંપ.[NEWLINE_PLACEHOLDER]]વીજળીને કારણે આગ પૂર પૂર (આ કવરેજ હાઇડ્રોફ્રિક પાકોને લાગુ પડશે નહીં) ભૂસ્ખલન તોફાન માત્ર હાથી જંગલી ભૂંડ દ્વારા પ્રાણીનો હુમલો	ત્રીજા
7.	ઉપરોક્ત ઉત્પાદન માટે ઉપલબ્ધ એડ-ઓન કવર	એનિમલ એટેક કવરેજ હેઠળ, નીલગાય પ્રાણી ફક્ત મધ્યપ્રદેશ રાજ્ય માટે એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે. એડ-ઓન કવર UIN નંબર હેઠળ છે:	શબ્દો ઉમેરો
8.	કપાતપાત્ર / વધારાનું / સહ-ચુકવણી અને અવમૂલ્યન, અલ્પ વીમો	આ નીતિ હેઠળ કરવામાં આવેલા દરેક દાવા માટે રૂ. ૫૦૦/- અથવા દાવાની આકારણી રકમના ૫% જે વધારે હોય તે.	આપણે
9.	બાકાત (નીતિમાં શું આવરી લેવામાં આવતું નથી)	કંપની નીચેના કારણે થયેલા નુકસાન અને નુકસાનને આવરી લેશે નહીં. યુદ્ધનું જોખમ: યુદ્ધ, આક્રમણ, વિદેશી દુશ્મનના કૃત્ય, દુશ્મનાવટ (યુદ્ધ જાહેર કરવામાં આવે કે ન આવે) ગૃહયુદ્ધ, બળવો, ક્રાંતિ, બળવો, લશ્કરી અથવા હડપાયેલી સત્તા, જમી, રાષ્ટ્રીયકરણ, નાગરિક હંગામો, લૂંટ, તેના સંબંધમાં લૂંટ. પરમાણુ જોખમ: આયનાઇઝિંગ રેડિયેશન અથવા કોઈપણ પરમાણુ બળતણમાંથી કિરણોત્સર્ગ દ્વારા દૂષણ અથવા પરમાણુ બળતણના દહનમાંથી કોઈપણ પરમાણુ કચરા અથવા કોઈપણ પરમાણુ એસેમ્બલી અથવા પરમાણુ ઘટકના કિરણોત્સર્ગો, ઝેરી, વિસ્ફોટક અથવા જોખમી ગુણધર્મોથી ઉદ્ભવતા વીમાકૃત પાકને કોઈપણ નુકસાન. પરિણામી નુકસાન: કોઈપણ પ્રકારનું અથવા વર્ણનનું પરિણામી નુકસાન. દુર્ભાવનાપૂર્ણ નુકસાન, આગચંપી અને અન્ય અટકાવી શકાય તેવા જોખમો.[NEWLINE_PLACEHOLDER]]આતંકવાદ: આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે પાકને થયેલ કોઈપણ નુકસાન.[NEWLINE_PLACEHOLDER]]કોઈપણ પ્રકારનું પ્રદૂષણ અથવા દૂષણ.[NEWLINE_PLACEHOLDER]]કોઈપણ સરકાર	IV

		અથવા અન્ય કોઈપણ નાગરિક સત્તાવાળાના આદેશથી થયેલ રાજકીય જોખમ અથવા નુકસાન; જ્વાળામુખી ફાટવું, દરિયાકાંઠાનો અથવા નદીનું ધોવાણ અથવા કુદરતી રીતે થતા અન્ય આંચકા. ચોરી, હુલ્લડ અને હડતાળ. પાકના ઉત્પાદન માટે કાપણી પછીનું નુકસાન, ભલે તે વીમાકૃત ખેતરમાં કાપેલા અને ફેલાયેલા હોય. તે સિવાયના કોઈપણ પ્રાણી દ્વારા થયેલ નુકસાન / નુકસાન કલમ ૩ હેઠળ ઉલ્લેખિત છે, એટલે કે કવરેજ. જળપ્રવાહ સામે હાઇડ્રોફ્રિક પાકનું કવરેજ.[NEWLINE_PLACEHOLDER]કોઈપણ અન્ય જોખમ દ્વારા, જે પોલિસી શેડ્યૂલમાં સ્પષ્ટપણે આવરી લેવામાં આવ્યું નથી. સ્ટેકિંગ, ટ્રેલીસ વગેરે જેવા સહાયક માળખાનો ખર્ચ.[NEWLINE_PLACEHOLDER]આંતરપાક અને મિશ્ર પાક ખેતી.[NEWLINE_PLACEHOLDER]વીમાકૃત ખેતરના બહુકોણ / અક્ષાંશ અને રેખાંશ અને ક્ષતિગ્રસ્ત ખેતર વચ્ચે મેળ ખાતો નથી.[NEWLINE_PLACEHOLDER]વધારાનો દાવો કરો.[NEWLINE_PLACEHOLDER]કોઈપણ નુકસાનના સંબંધમાં અથવા તેના સંદર્ભમાં તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ ખર્ચ, ગમે તે હોય, ભલે આવા નુકસાનના પરિણામે કૃષિ ઉત્પાદન / ઉપજમાં ઘટાડો થાય અથવા કામગીરીમાં વધારો થાય. ખર્ચ ચૂકવવાપાત્ર રહેશે નહીં. ખેતરમાંથી કોઈપણ નુકસાન પામેલા પાક, કાટમાળ, અથવા કોઈપણ પદાર્થ/પદાર્થોને દૂર કરવા માટે તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ ખર્ચ, પછી ભલે તે નુકસાન આવરી લેવામાં આવેલા જોખમોને કારણે થયું હોય કે અન્યથા, ચૂકવવાપાત્ર રહેશે નહીં. પાકનું નુકસાન જ્યાં નુકસાન અથવા નુકસાનનું સ્થાન દરખાસ્ત સમયે ઓળખાયેલ બહુકોણ સાથે છેદતું નથી ઉપજનું નુકસાન. નર્સરીમાં ઉગાડવામાં આવતા પાક. પ્રતીક્ષા સમયગાળા દરમિયાન નુકસાન થયું છે કોઈપણ કપટી અથવા અતિશયોક્તિપૂર્ણ દાવા.	
10.	ખાસ શરતો અને વોરંટી (જો કોઈ હોય તો)	કોઈપણ ખાસ જોગવાઈઓ જેના આધારે આ નીતિ દાખલ કરવામાં આવી છે અને નીતિમાં સમર્થન આપવામાં આવ્યું છે તે આ નીતિનો ભાગ માનવામાં આવશે અને તે મુજબ અમલમાં આવશે. નુકસાન થવા પર, નુકસાન હેઠળના વિસ્તારની હદ સુધી પ્રમાણસર વીમાકૃત રકમ વીમાકૃત વિસ્તાર માટે કુલ વીમાકૃત રકમમાંથી ઘટાડવામાં આવે છે. પ્રતીક્ષા સમયગાળો:	VI

		આ નીતિમાં દરખાસ્તમાં તમારા દ્વારા જાહેર કરાયેલ પાક સમયગાળાના 15% દિવસથી ઓછો રાહ જોવાનો સમયગાળો અથવા શરૂઆતની તારીખથી અથવા બદલાયેલી વાવણી તારીખ / પાકથી પહેલા 21 દિવસનો રાહ જોવાનો સમયગાળો છે. જો રાહ જોવાના સમયગાળા દરમિયાન નુકસાન અથવા નુકસાન થાય છે, તો ક્ષતિગ્રસ્ત વિસ્તારની વીમાકૃત રકમ બાકીના પોલિસી સમયગાળા માટે નુકસાન પામેલા કુલ વિસ્તારમાંથી ખતમ થઈ ગઈ હોવાનું માનવામાં આવશે.	
11.	દાવાની સ્વીકાર્યતા	દાવો દાખલ કરવાની પ્રક્રિયા: ક્ષેમા એપ્લિકેશન દ્વારા અથવા customer.support@kshema.co પર ઇમેઇલ દ્વારા અથવા ટોલ-ફ્રી નંબર 18005723013 પર અથવા અમારી વેબસાઇટ https://kshema.co/ દ્વારા તાત્કાલિક નુકસાનની જાણ કરો, સાથે સાથે જોખમ થયાના 24 કલાકની અંદર તમારી પોલિસી વિગતો પણ જણાવો. ક્ષેમા એપ્લિકેશનનો ઉપયોગ કરીને નુકસાન થયેલા પાકના તારીખ અને સમય સ્ટેમ્પ સાથે જીઓ-ટેગ કરેલા ફોટોગ્રાફ્સ લો. ક્ષેમા એપ્લિકેશનનો ઉપયોગ કરીને સમગ્ર વીમાકૃત ખેતર અને ખેતરના અસરગ્રસ્ત ભાગની વિડિઓ ક્લિપ્સ લો. ક્ષેમા એપ્લિકેશનનો ઉપયોગ કરીને અંદાજિત વિસ્તાર સાથે નુકસાન / નુકસાનનું સંપૂર્ણ વર્ણન આપો. નુકસાન સમયે સમાન વીમાધારક પાકને આવરી લેતી કોઈપણ અન્ય વીમા પોલિસીની વિગતો જણાવો. ક્ષેમા દ્વારા નુકસાન ચકાસણી/મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી નુકસાન પામેલા પાકનું રક્ષણ કરો અને સાથે સાથે પાકના નુકસાનને ઘટાડવા માટે પગલાં લો. પાકનું કારણ, નુકસાન અને નુકસાન સ્થાપિત કરવા માટે બધા સહાયક દસ્તાવેજો / માહિતી પ્રદાન કરો અને કંપની દ્વારા જરૂરી કોઈપણ અન્ય માહિતી પ્રદાન કરો. કોઈપણ વીમા દાવાના કિસ્સામાં, નુકસાનની તારીખથી શરૂ કરીને દર બીજા દિવસે સાત દિવસના સમયગાળા માટે તારીખવાળા ફોટા અને વિડિઓ ક્લિપ્સ સબમિટ કરવામાં આવશે. નુકસાનની તારીખ મુજબ વીમાપાત્ર હિતનો પુરાવો સ્થાપિત કરતો દસ્તાવેજ. નુકસાનનું મૂલ્યાંકન અને ગણતરી: દાવો શોધ અને નુકસાનનું મૂલ્યાંકન ફક્ત રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છબી / ચિત્રો અને / અથવા ઇન-હાઉસ વિકસિત અલ્ગોરિથમનો ઉપયોગ કરીને ક્ષેમા એપ્લિકેશન દ્વારા સબમિટ કરાયેલ વિડિઓ ક્લિપ્સ દ્વારા કરવામાં આવશે; અને કવરેજ હેઠળ ઉલ્લેખિત જોખમો ફક્ત ત્યારે જ ઓળખવામાં આવશે જ્યારે સંબંધિત સરકાર / હવામાન / ભૂસ્તરશાસ્ત્રીય /	પાંચમ, આઠમ, નવમું

		આપત્તિ વ્યવસ્થાપન સત્તાવાળાઓ દ્વારા જાહેર અથવા પુષ્ટિ કરવામાં આવે, અથવા વીમાદાતાના સંતોષ માટે પુરાવા આપવામાં આવે; અથવા કોઈપણ અન્ય વિશ્વસનીય સ્થાનિક રેકૉર્ડ અથવા પુરાવા.[NEWLINE_PLACEHOLDER]]નુકસાન વળતરની ગણતરી નીચેના સૂત્રના આધારે કરવામાં આવશે. નુકસાન = (વીમા રકમ x પાકના તબક્કાના આધારે અનુરૂપ વળતર ટકાવારી x વીમાકૃત વિસ્તારની હદ x નુકસાન ટકાવારી ટકાવારી) - વધારાનો દાવો પાકના તબક્કાના આધારે વળતર ટકાવારી: વળતર ટકાવારી એ નુકસાનની ઘટના સમયે પાકના તબક્કાની ટકાવારી અને પાકના કુલ સમયગાળાની ટકાવારી હશે. નોંધ: જો નુકસાન સમયે પાકનો તબક્કો રાહ જોવાના સમયગાળામાં આવે છે, તો કોઈ વીમા દાવો ચૂકવવાપાત્ર રહેશે નહીં.	
12.	પોલિસી સર્વિસિંગ - દાવાની સૂચના અને પ્રક્રિયા	વીમા કંપનીનો ટોલ ફ્રી / IVRS નંબર: ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૫૭૨ ૩૦૧૩ વેબસાઇટ / ઇમેઇલ: www.kshema.co ની મુલાકાત લો અથવા customer.support@kshema.co આ પોલિસી હેઠળ આવરી લેવામાં આવેલા કોઈપણ જોખમની કમનસીબ ઘટનામાં, જેના પરિણામે પાકને નુકસાન અથવા નુકસાન થયું હોય, તો તમારે નીચેના પગલાં લેવા જરૂરી છે: ક્ષેમા એપ્લિકેશન દ્વારા અથવા customer.support@kshema.co પર ઇમેઇલ દ્વારા અથવા ટોલ-ફ્રી નંબર ૧૮૦૦૫૭૨૩૦૧૩ પર અથવા અમારી વેબસાઇટ https://kshema.co/ દ્વારા તાત્કાલિક નુકસાનની જાણ કરો, સાથે સાથે તમારી પોલિસી વિગતો પણ જોખમના ૨૪ કલાક પહેલાં કરો. નુકસાન ઘટાડવા માટે તમામ પગલાં લો, જાણે કોઈ વીમો લેવામાં આવ્યો ન હોય. ક્ષેમા પાકના જીઓ-ટેગવાળા ફોટોગ્રાફ્સ લો, ક્ષેમા એપ્લિકેશનનો ઉપયોગ કરીને તારીખ અને સમય સ્ટેમ્પ સાથે. ક્ષેમા એપ્લિકેશનનો ઉપયોગ કરીને સમગ્ર વીમાકૃત ક્ષેત્ર અને ક્ષેત્રના અસરગ્રસ્ત ભાગની વિડિઓ ક્લિપ્સ લો. નુકસાન / નુકસાનનું સંપૂર્ણ વર્ણન આપો, જેમાં અંદાજિત વિસ્તાર, સમય અને તારીખ અને નુકસાનના સ્થળનો સમાવેશ થાય છે. નુકસાન સમયે સમાન વીમાકૃત પાકને આવરી લેતી કોઈપણ અન્ય વીમા પોલિસીની વિગતો જણાવો. ક્ષેમા દ્વારા નુકસાન ચકાસણી/મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી નુકસાન પામેલા પાકનું રક્ષણ કરો અને સાથે સાથે પાકના	વી

		નુકસાનને ઘટાડવા માટે પગલાં લો. પાકનું કારણ, નુકસાન અને નુકસાન સ્થાપિત કરવા માટે બધા સહાયક દસ્તાવેજો / માહિતી પ્રદાન કરો અને કંપની દ્વારા જરૂરી કોઈપણ અન્ય માહિતી પ્રદાન કરો. કોઈપણ વીમા દાવાના કિસ્સામાં, નુકસાનની તારીખથી શરૂ કરીને સાત દિવસના સમયગાળા માટે દર બીજા દિવસે તારીખવાળા ફોટા અને વિડિઓ ક્લિપ્સ સબમિટ કરવામાં આવશે. નુકસાનની તારીખે વીમાપાત્ર હિતનો પુરાવો સ્થાપિત કરતો દસ્તાવેજ.	
13.	ફરિયાદ નિવારણ અને પોલિસીધારકોનું રક્ષણ	વીમા ઉદ્યોગમાં પોલિસીધારકોના હિતોનું રક્ષણ એ એક મૂળભૂત પાસું છે જેનો ઉદ્દેશ્ય વીમા પોલિસી ધરાવતા વ્યક્તિઓ અથવા સંસ્થાઓના અધિકારોનું રક્ષણ કરવાનો અને તેમના સાથે ન્યાયી વર્તન સુનિશ્ચિત કરવાનો છે. પારદર્શિતા અને ખુલાસાઓ, ન્યાયી વર્તન, નિયમોનું પાલન, ગોપનીયતા અને ડેટા સુરક્ષા, દાવાઓનું ઝડપી સમાધાન, ફરિયાદ નિવારણ પદ્ધતિઓ વગેરે સુનિશ્ચિત કરવા માટે પોલિસીધારકોના હિતોને જાળવી રાખવા માટે વિવિધ નિયમનકારી માળખા, માર્ગદર્શિકા અને ઉદ્યોગ પ્રથાઓ અમલમાં છે. વીમા કંપનીના ફરિયાદ નિવારણ અધિકારીની વિગતો: gro@kshema.co પર મુખ્ય ફરિયાદ અધિકારી બીમા ભરોસા પોર્ટલ: https://bimabharosa.irdai.gov.in/ લોકપાલ: http://www.cioins.co.in/ombudsman.htm ટોલ ફ્રી નંબર 1800 572 3013 અથવા અમને customer.support@kshema.co પર ઇમેઇલ કરો.	XIV
14.	સંભવિત પોલિસીધારક / ગ્રાહકની જવાબદારીઓ	દરખાસ્ત ફોર્મ ભરતી વખતે બધી મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવી: તમે દરખાસ્ત ફોર્મમાંની બધી મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવા માટે બંધાયેલા છો. જો તમારા દ્વારા છેતરપિંડી કરવામાં આવે તો, પોલિસી રદબાતલ રહેશે. તમે લેખિતમાં અથવા ક્ષેમા એપ્લિકેશન દ્વારા અમને સૂચના આપીને કોઈપણ સમયે આ પોલિસી રદ કરી શકો છો. અમને તમારી સૂચના મળતાં જ પોલિસી સમાપ્ત થઈ જશે. છેતરપિંડીના કારણ સિવાય અમે પોલિસી સમયગાળા દરમિયાન નીતિ રદ કરીશું નહીં. બંને કિસ્સાઓમાં, સમાપ્ત ન થયેલા સમયગાળા માટે પ્રમાણસર પ્રીમિયમ પરત કરવામાં આવશે. પહેલાથી જાહેર કરાયેલ માહિતીમાં કોઈપણ ફેરફાર / ફેરફાર / વધારાના કિસ્સામાં તે તાત્કાલિક વીમા કંપનીના ધ્યાન પર લાવવામાં આવશે. મહત્વપૂર્ણ માહિતી જાહેર ન કરવાથી દાવાની પતાવટ પર અસર	XII, VI

		થઈ શકે છે. આ પોલિસી મોબાઇલ એપ્લિકેશન દ્વારા સંચાલિત છે; વિગતો અરજીમાં જ આપવાની રહેશે. ખેતરની સીમાઓ જીઓ-ટેગ કરેલી હોવી જોઈએ અને KYC અને ખેતરની વિગતો માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા જોઈએ. પોલિસી સમયગાળા દરમિયાન અન્ય મહત્વપૂર્ણ માહિતીનો ખુલાસો: વીમાધારક અમારી ગ્રાહક સેવાઓનો ટોલ ફ્રી નંબર 1800 572 3013 પર ફોન દ્વારા સંપર્ક કરી શકે છે અથવા customer.support@kshema.co પર અમને લખીને નીતિને અસર કરતી મહત્વપૂર્ણ માહિતીમાં કોઈપણ ફેરફારની જાણ કરી શકે છે. જાહેરાતની નિર્વિવાદતા અને ફરજ: આ નીતિ રદબાતલ થઈ જશે અને દરખાસ્ત ફોર્મ અને/અથવા વ્યક્તિગત નિવેદન અને/અથવા દરખાસ્ત ફોર્મ (DPF) અને/અથવા જોડાયેલ દસ્તાવેજો દ્વારા કરવામાં આવેલા કોઈપણ મહત્વપૂર્ણ ફેરફાર અથવા વિશેષતાનો ખોટો અથવા ખોટો નિવેદનો, ખોટી રજૂઆત, ખોટું વર્ણન, અથવા બિન-જાહેરાતના કિસ્સામાં તેના હેઠળ કોઈ લાભ ચૂકવવાપાત્ર રહેશે નહીં. પાક મેળ ખાતો નથી: નીતિ શરૂઆતથી જ રદબાતલ થઈ જાય છે, અને જો પાક જાહેર કરવામાં આવ્યો હોય તો કોઈ નુકસાન/નુકસાન ચૂકવવાપાત્ર રહેશે નહીં. વીમા સમયે તમારા દ્વારા લેવાયેલ વીમો અને વીમાકૃત ખેતર પરનો વાસ્તવિક પાક અલગ છે. ચૂકવવામાં આવેલ પ્રીમિયમ સંપૂર્ણ રીતે જમ કરવામાં આવશે અને પોલિસી રદબાતલ રહેશે. પ્રથાઓનું પાક પેકેજ: વીમાધારક પાકને લગતી બધી પદ્ધતિઓનું પાલન કરશે અને સિંચાઈ, નીંદણ, છોડ સંરક્ષણ વગેરે જેવી બધી પ્રવૃત્તિઓ સમયસર કરશે, નિર્ધારિત પદ્ધતિઓના પેકેજને હાથ ધરવામાં કોઈપણ નિષ્ફળતા માટે સંબંધિત ઇનપુટ ખર્ચ દાવાની રકમમાંથી બાદ કરવામાં આવશે. વધારાની રકમ: તમારે દરેક માટે રૂ. 500/- અથવા દાવાની આકારણી રકમના 5% જે વધારે હોય તે સહન કરવું પડશે, અને આ પોલિસી હેઠળ કરવામાં આવેલ દરેક દાવા. નામિત જોખમ નીતિ: આ પોલિસી ફક્ત તે જોખમો માટે કવરેજ પ્રદાન કરે છે જે પોલિસી શેડ્યૂલમાં આવરી લેવામાં આવ્યા છે તે મુજબ ખાસ સૂચિબદ્ધ અથવા સ્પષ્ટ રીતે જણાવેલ છે. આ પોલિસીમાં નામ આપવામાં આવેલ અથવા ઉલ્લેખિત ન હોય તેવા જોખમોથી ઉદ્ભવતા કોઈપણ નુકસાન અથવા નુકસાનને આવરી લેવામાં આવતું નથી. આ પોલિસીમાં આપેલી બાકાતની યાદી ફક્ત ઉદાહરણ તરીકે છે અને તે કોઈપણ જોખમોને આવરી લેતી નથી જેને સ્પષ્ટ રીતે આવરી લેવામાં આવી નથી. ફાળો કલમ: જો એક જ ખેતીની જમીનમાં એક જ પાકનો એક	
--	--	---	--

	કરતાં વધુ વીમા પોલિસી હેઠળ વીમો લેવામાં આવ્યો હોય અને જો ઉપરોક્ત ખેતીની જમીન પર નુકસાન થાય અને નુકસાન બહુવિધ વીમા પોલિસી હેઠળ આવરી લેવામાં આવે, તો અમે અન્ય વીમા પોલિસીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા કવરેજના આધારે દાવાની રકમનો માત્ર એક જ પ્રમાણ ચૂકવવા માટે જવાબદાર રહીશું. વાવણી તારીખ: જો વાવણીની તારીખ ક્વોટેશન તારીખથી 15 દિવસ કરતાં વધુ વહેલી હોવાનું જાણવા મળે, તો પોલિસી રદબાતલ ગણવામાં આવશે અને કોઈ દાવો ચૂકવવાપાત્ર રહેશે નહીં. પાકમાં ફેરફાર: વીમા દરખાસ્ત સમયે જાહેર કરાયેલ પાકમાંથી પાકમાં એક વખત ફેરફારની મંજૂરી આપવામાં આવશે, જો વાવણીના 5 દિવસની અંદર ફેરફારની જાણ કરવામાં આવે તો. વાવણીની તારીખમાં ફેરફાર: વાવણીની તારીખમાં એક વખત ફેરફાર કરવાની મંજૂરી છે જે પ્રીમિયમ ચૂકવણી તારીખથી વહેલા ન હોય, વાવણીના 5 દિવસની અંદર લેખિતમાં જાણ કરવાની શરતે. 7 દિવસની કલમ: નુકસાનની ઘટનાની શરૂઆતથી શરૂ કરીને સતત 7 દિવસના સમયગાળા દરમિયાન સમાન અસરગ્રસ્ત બહુકોણમાં નામાંકિત જોખમોથી ઉદ્ભવતા વીમાકૃત પાકને થયેલ કોઈપણ નુકસાનને એક જ ઘટના માનવામાં આવશે અને તેથી એક દાવા વધારા અને એક દાવાને આધીન રહેશે. ફરજિયાત દસ્તાવેજો: વીમા દાવા સમયે, ફરજિયાત પાકના નુકસાન / નુકસાનના ફોટા, અક્ષાંશ અને રેખાંશ કોઓર્ડિનેટ્સ સાથે, ઘટનાની તારીખથી શરૂ કરીને નુકસાન / નુકસાન સંપૂર્ણપણે ઓછું થાય ત્યાં સુધી 2 દિવસના કડક અંતરાલે સબમિટ કરવા પડશે. વાજબી સંભાળ: તમારે પાક વીમાધારકના હિતોને નુકસાન અથવા નુકસાન સામે રક્ષણ આપવા માટે તમામ વાજબી પગલાં લેવા પડશે જે દાવાને જન્મ આપી શકે છે. નિયમો અને શરતોનું પાલન: આ નીતિના નિયમો, શરતો અને સમર્થનનું યોગ્ય પાલન અને પરિપૂર્ણતા, જ્યાં સુધી તે તમારા દ્વારા કરવામાં આવનાર અથવા પાલન કરવામાં આવનાર કોઈપણ બાબત સાથે સંબંધિત છે, આ નીતિ હેઠળ કોઈપણ નુકસાન વળતર ચૂકવણી કરવા માટે અમારા પરની કોઈપણ જવાબદારી માટે પૂર્વશરત રહેશે. આ નીતિના નિયમો અને શરતોનું પાલન ન કરવાથી આ નીતિ રદબાતલ થશે. કોઈપણ ખાસ જોગવાઈઓ જેના આધારે આ નીતિ દાખલ કરવામાં આવી છે અને નીતિમાં સમર્થન આપવામાં આવ્યું છે તે આ નીતિનો ભાગ માનવામાં આવશે અને તે મુજબ અમલમાં આવશે.	
--	--	--

	પ્રતીક્ષા સમયગાળો: આ નીતિમાં દરખાસ્તમાં અથવા પહેલા 21 દિવસમાં તમારા દ્વારા જાહેર કરાયેલ પાક સમયગાળાના 15% દિવસથી ઓછો રાહ જોવાનો સમયગાળો છે. શરૂઆતની તારીખથી અથવા બદલાયેલી વાવણી તારીખ / પાકથી. જો રાહ જોવાના સમયગાળા દરમિયાન નુકસાન અથવા નુકસાન થાય છે, તો ક્ષતિગ્રસ્ત વિસ્તારની વીમા રકમ બાકીના પોલિસી સમયગાળા માટે કુલ નુકસાન થયેલા વિસ્તારમાંથી ખતમ થઈ ગઈ હોવાનું માનવામાં આવશે. પાક વ્યવસ્થાપન કલમ: સમયસર અને પર્યાપ્ત નિંદામણ, સિંચાઈ, જીવાત અથવા રોગો અથવા પોષણની ઉણપ અથવા અતિશય ખનિજ / પોષક તત્વો નિયંત્રણ અથવા અન્ય આવશ્યક કૃષિ પદ્ધતિઓ જેવી અયોગ્ય પાક વ્યવસ્થાપન પદ્ધતિઓના કિસ્સામાં, જેના પરિણામે પાકને નુકસાન અથવા નુકસાન અથવા અયોગ્ય વૃદ્ધિ થાય છે, દાવાની રકમ કુલ પાત્ર દાવાના મહત્તમ 25% સુધી ઘટાડી શકાય છે, જે બેદરકારીની ગંભીરતા અને અસર પર આધાર રાખે છે. નો દાવો ડિસ્કાઉન્ટ (NCD): જ્યારે તમારી પાછલી પોલિસી પર કોઈ દાવો કરવામાં ન આવે ત્યારે કંપની પ્રીમિયમના 2.5% ના સ્વેબમાં ડિસ્કાઉન્ટની મંજૂરી આપશે. જો વીમાધારક એક સીઝન માટે અગાઉ વીમા કરાયેલા ફાર્મ બહુકોણ માટે વીમો ખરીદવાનું છોડી દે તો પણ વીમાધારક નો ક્લેમ ડિસ્કાઉન્ટ માટે પાત્ર રહેશે. જોકે, જો ખેતી બહુકોણનો સતત બે સીઝન માટે વીમો લેવામાં ન આવે તો કમાયેલ NCD ખોવાઈ જશે.[NEWLINE_PLACEHOLDER]]NCD દરેક પોલિસી માટે લાગુ પડશે.[NEWLINE_PLACEHOLDER]]જો ખેડૂત વીમાકૃત વિસ્તાર વધારે છે, તો NCD એ પાછલી પાક સીઝનમાં વીમાકૃત વિસ્તારની હદ લાગુ કરશે જેમાં ખેડૂતે ડિસ્કાઉન્ટ મેળવ્યું હતું.[NEWLINE_PLACEHOLDER]]ડિસ્કાઉન્ટ ફક્ત ત્યારે જ લાગુ થશે જો એ જ ખેડૂત દ્વારા એ જ ફાર્મ બહુકોણનો વીમો લેવામાં આવ્યો હોય.[NEWLINE_PLACEHOLDER]]મહત્તમ ડિસ્કાઉન્ટ ચોખ્ખા પ્રીમિયમના 15% થી વધુ ન હોવું જોઈએ.[NEWLINE_PLACEHOLDER]]જો પોલિસી પર દાવો કરવામાં આવે, તો કમાયેલ NCD શૂન્ય થઈ જાય છે.[NEWLINE_PLACEHOLDER]] લોયલ્ટી બોનસ: કંપની પુનરાવર્તિત ગ્રાહકોને લોયલ્ટી બોનસ તરીકે પ્રીમિયમ ડિસ્કાઉન્ટ આપે છે, જો ખેડૂત અગાઉના પાકમાં સમાન હદ	
--	---	--

		અથવા વધુ જમીનનો વીમો લેતો હોય. સીઝન. વર્તમાન વીમામાં ચોખ્ખા પ્રીમિયમના ફ્લેટ 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ખેડૂત આગામી પાક સીઝનમાં પોતાના ખેતરનો વીમો ન કરાવે તો પણ ડિસ્કાઉન્ટ માટે પાત્ર રહેશે, પરંતુ સતત બે પાક સીઝનથી વધુ નહીં. જો ખેડૂત વીમા કરાવેલ ખેતરનો જથ્થો ઘટાડે છે તો ડિસ્કાઉન્ટ પ્રમાણસર ઘટાડવામાં આવશે.	
--	--	---	--

પોલિસીધારક દ્વારા ઘોષણા

મેં ઉપરોક્ત વાંચ્યું છે અને વિગતો નોંધ્યાની પુષ્ટિ કરું છું.

સ્થળ: (પોલીસીધારકની સહી)

તારીખ:

નોંધ:

- તમે અમારી વેબસાઇટ <https://kshema.co/> પર CIS સહિત પોલિસી સંબંધિત દસ્તાવેજો વાંચી શકો છો.
- કોઈપણ સંઘર્ષના કિસ્સામાં, પોલિસી દસ્તાવેજમાં ઉલ્લેખિત નિયમો અને શરતો માન્ય રહેશે.